

November 16, 2024

To,
Department of Corporate Services
BSE Limited
Ground Floor, P. J. Towers,
Dalal Street, Fort,
Mumbai- 400 001

Security ID: ASHNI
Security Code: 541702

Sub: Copy of Advertisement of Unaudited Financial Results for the quarter and half year ended on September 30, 2024.

Dear Sir/Madam,

Please find enclosed herewith copy of Advertisement of Unaudited Financial Results for the quarter and half year ended on September 30, 2024 as per Regulation 47(1)(b) and 47(3) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 published in one English daily newspaper and one daily newspaper in the language of the region, where the registered office of the company is situated.

Please take the same on your record.

Thanking You,

Yours faithfully,

For Ashnisha Industries Limited



Ashok C. Shah
Managing Director
DIN: 02467830



Encl: As above

CM Yogi calls to create safe, supportive environment for children's growth



Lucknow, Uttar Pradesh Chief Minister Yogi Adityanath on Thursday extended his greetings on the occasion of Children's Day and called for creating a safe and supportive environment for the children to grow. Taking to X, CM Yogi wrote, "Hearty congratulations and best wishes to all the dear children and residents of the state on 'Children's Day!' "Children are the future of the nation and the foundation of a 'developed and self-reliant India,' he added. "Let us create a safe, supportive and conducive

at some of the world's most renowned institutions including Harrow School in London and University of Cambridge. "Chacha Nehru" was deeply committed to the welfare of children and their education. After his passing in 1964, it was decided that November 14 would be observed as Children's Day to honour his legacy. The first official celebration took place in 1965, marking the beginning of an annual tradition to promote children's rights and emphasise their importance in building India's future.

PUROHIT CONSTRUCTION LIMITED
CIN : L45200GJ1991PLC015878
REGD.OFFICE-401, PUROHIT HOUSE, OPP. STADIUM, NAVRANGPURA, AHMEDABAD-380 009
Telephone Number- 079-26426486, Email- id: cpurohit@purohitconstruction.com
Website: www.purohitconstruction.com

STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30th SEPTEMBER, 2024
(Rs. in Lakhs except EPS)

Sl.No.	Particulars	Three Months ended		Half Year Ended		Year ended 30/09/2024 (Audited)
		30/09/2024 (Unaudited)	30/09/2023 (Unaudited)	30/09/2024 (Unaudited)	30/09/2023 (Unaudited)	
1	Total Income from Operations	0.00	0.00	0.00	0.00	0.00
2	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	-8.78	-9.07	-17.85	-24.41	-43.99
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	-8.78	-9.07	-17.85	-24.41	-43.99
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	-9.00	-1.85	-16.61	-26.27	-46.52
5	Comprising Profit / (Loss) for the period (after Exceptional and/or Extraordinary Items) (after Equity Share Capital (Equity Shares of Rs. 10/- each))	-6.00	-1.85	-16.61	-26.27	-46.52
6	Reserves (including Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	440.56	440.56	440.56	440.56	440.56
7	Earnings Per Share (Face Value of Rs. 10/- each) (for continuing and discontinued operations)	-	-	-	-	0.00
8	Basic	-0.30	-0.17	-0.34	-0.60	-1.06
	Diluted	-0.30	-0.17	-0.34	-0.60	-1.06

Notes:
1. The Above Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on 14.11.2024.
2. The above result for the quarter and half year ended on 30/09/2024 has been prepared in accordance with the Companies (Drum Accounting Standards) Rules 2015 (nd AS), prescribed under section 123 of the Companies Act 2013 and other recognised accounting practices and policies to the extent applicable.
3. The Limited Review of Unaudited Financial Results for the Quarter and half year ended September 30, 2024 as required in terms of Clause 33 of SEBI (LODR) Regulations, 2015 has been carried out by Statutory Auditors.
4. The Company primarily engaged only in the business of real estate development. As the Company operates in a single business geography, the disclosure of such segment-wise information as defined in "IND AS 108 - Operating Segments" is not required and accordingly not provided.
5. The above financial results are available on the Company's website www.purohitconstruction.com and also on the website of BSE (www.bseindia.com).

For and on behalf of the Board of Directors
NARENDRA M. PUROHIT
(Chairman & Managing Director)
DIN:00795195

Place : Ahmedabad
Date : 14-11-2024

Acclaimed author Berjis Desai unveils tense crime thriller

Ahmedabad, Renowned lawyer and acclaimed author Berjis Desai has launched his latest novel, Murder at the Racecourse, a thrilling dive into the dark underbelly of the high-stakes world of horse racing. Following his critically acclaimed works Oh! Those Parsis, The Bajawji, and Towers of Silence, Desai's new novel, packed with intrigue, scandal and unexpected twists is already creating a buzz among fans of crime and mystery fiction. Set against the thrilling backdrop of the racecourse where fortunes are made in seconds, Murder at the Racecourse unravels the murder of Nari Mansukhani,



a notorious trainer, whose death triggers a chain of events that spiral out of control and rock the world of horse racing. The investigation that follows exposes a deadly cocktail of scandal, doping and betrayals, perplexing India's top sleuths. The captivating book keeps readers on the edge with every turn of the page. (20-4)

Nick brings the joy of imagination to life in Ahmedabad



Ahmedabad, One of the most magical things about kids is their ability to imagine without limits, creating worlds full of endless possibilities. This Children's Day, Nick India celebrated the boundless creativity of children, making the day unforgettable with fun, laughter, and endless experiences!

ED raids premises of 'Lottery King' Santiago Martin, son-in-law Aadhav Arjuna

Chennai, Officials from the Enforcement Directorate (ED) are conducting raids at the residences of Santiago Martin, popularly known as the 'Lottery King', and his son-in-law Aadhav Arjuna. The raids are taking place in Coimbatore and Chennai, respectively. Aadhav Arjuna currently serves as the Deputy General Secretary of the Viduthala Chiruthalga Katchi (VCK), a prominent Dalit political party in Tamil Nadu. A former national-level basketball player, Arjuna recently joined the VCK. He stirred a controversy by openly criticising the DMK and its first family, even though VCK is part of the INDIA bloc in Tamil Nadu. Arjuna has also called for the representation of allies in the DMK government.

ASHNISHA INDUSTRIES LIMITED
CIN : L74110GJ2009PLC057629
Registered Office : 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospital, Mihakhali Six Roads, Ahmedabad - 380006.

STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED SEPTEMBER 30, 2024.
(Rs. in Lakhs)

PARTICULARS	Quarter Ending		Corresponding 3 months ended in the previous year	Year to date
	30.09.2024 (Unaudited)	30.06.2024 (Unaudited)		
Total income from operations	96.52	150.01	255.06	246.55
Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	1.60	5.08	30.96	6.70
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	1.60	5.08	30.96	6.70
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	0.76	5.08	24.08	5.86
Total Comprehensive Income for the period (Comprising profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax))	0.76	5.08	24.08	5.86
Equity Share Capital	1010.00	1010.00	990.00	1010.00
Other Equity	-	-	-	4959.53
Earnings Per Share (before extraordinary items) (of Rs. 1/- each) (not annualised)	0.001	0.005	0.020	0.006
Basic:	0.001	0.005	0.020	0.006
Diluted:	0.001	0.005	0.020	0.006

STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED SEPTEMBER 30, 2024.
(Rs. in Lakhs)

PARTICULARS	Quarter Ending		Corresponding 3 months ended in the previous year	Year to date
	30.09.2024 (Unaudited)	30.06.2024 (Unaudited)		
Total Income from operations	74.09	48.56	204.31	122.65
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	2.64	3.89	27.82	6.53
Profit after tax	1.80	3.89	22.01	5.69

Notes:
The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and the company's website (www.ashnishaind.com).

For, Ashnisha Industries Limited,
Date : 14.11.2024
Place : Ahmedabad
Ashok C. Shah, Managing Director, Din: 02467830

YASH CHEMEX LIMITED
411, 4th Floor, Sigma Icon-1, Opp. Medlink Hospital, Satellite, Ahmedabad - 380015.
Tele : 079-40028639/26730257/26730258, Email : yashchem@hotmail.com, Website : www.yashchemex.com, CIN : L74110GJ2006PLC048385

STATEMENT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE SECOND QUARTER AND THE HALF YEAR ENDED SEPTEMBER 30, 2024.
(Rs. in Lakhs)

Sr. No.	PARTICULARS	Standalone Un-Audited Financial Results				Consolidated Un-Audited Financial Results				
		Quarter Ended 30/09/2024	Quarter Ended 30/06/2024	Quarter Ended 30/09/2023	Year Ended 31/03/2024	Quarter Ended 30/09/2024	Quarter Ended 30/06/2024	Quarter Ended 30/09/2023	Year Ended 31/03/2024	
1.	Total Income from Operations	1,555.02	793.22	1,311.50	6,214.74	2,495.73	1,369.28	1,939.22	9,552.57	
2.	Net Profit for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	44.11	75.87	46.30	-156.45	176.35	207.99	193.32	-7.08	
3.	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	44.11	75.87	46.30	-156.45	176.35	207.99	193.32	-7.08	
4.	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	51.77	23.76	33.17	-91.23	197.04	126.02	151.10	32.86	
5.	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	66.88	-13.43	48.97	-36.01	212.15	88.83	166.91	86.87	
6.	Equity Share Capital of Face Value Rs. 10/- Each	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	
7.	Earnings Per Share (face value of Rs. 1/- each) (for continuing and discontinued operations)	A : Basic	0.51	0.23	0.32	(0.89)	1.47	0.93	0.73	(0.27)
	B : Diluted	0.51	0.23	0.32	(0.89)	1.47	0.93	0.73	(0.27)	

Notes:-
1. The above is an extract of the detailed format of Unaudited Standalone and Consolidated Financial Results for the Second Quarter and the Half Year ended September 30, 2024 filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Standalone and Consolidated Financial Results for the Second Quarter and the Half Year ended September 30, 2024 are available on the Stock Exchange website i.e. www.bseindia.com and www.rnsindia.com and on the website of the Company i.e. www.yashchemex.com.
2. The above Unaudited Standalone Financial Results for the Second Quarter and the Half Year ended September 30, 2024 have been reviewed by the Audit Committee & approved by the Board of Directors of the Company at their respective meetings held on Thursday, November 14, 2024.

By Order of Board of Directors,
For Yash Chemex Limited
SD/-, Pritesh Y. Shah,
Managing Director,
DIN: 02236663

Place : Ahmedabad
Date : 14.11.2024

DISHA RESOURCES LIMITED
Regd. Office : 3, Rajesh Apartment, B/h. Ajanta Comm. Estate, Ashram Road, Ahmedabad - 380014,
Phone : (OFF), 2754-0790, 27543060, E-mail : disharesourceslimited@gmail.com
CIN : L74110GJ1995PLC024869, Website : www.disharesourcesltd.com

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE SECOND QUARTER AND HALF YEAR ENDED AS ON 30th SEPTEMBER, 2024.
(In Lakhs)

PARTICULARS	Quarter Ended		Six Months Ended		Year Ended	
	30-Sept-24 Unaudited	30-June-24 Unaudited	30-Sept-23 Unaudited	30-Sept-23 Unaudited		
Revenue from Operations	3.25	-	140.74	3.25	140.74	
Other Income	0.12	1.18	1.17	1.30	276.43	
Total Income from Operation	3.37	1.18	141.91	4.55	417.17	
Net profit/(Loss) for the period (before tax, Exceptional and/or extraordinary items)	(21.71)	(8.19)	(2.57)	(29.90)	263.17	
Net profit/(Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	(21.71)	(8.19)	(2.57)	(29.90)	263.17	
Net profit/(Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	(21.19)	(5.79)	(2.28)	(26.80)	233.88	
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and other comprehensive income (after tax))	7.11	299.54	539.26	306.65	779.39	
Paid-up equity Share Capital	731.55	731.55	731.55	731.55	731.55	
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	3395.67	3388.57	3551.51	3395.67	3551.51	
Earnings per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	Basic	0.11	4.08	7.37	4.19	10.65
	Diluted	0.11	4.08	7.37	4.19	10.65

Notes ->
1. The above is an extract of the detailed format of quarter and three months ended unaudited Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited Financial Results is available on the stock exchange website - www.bseindia.com on a company's website - www.disharesourcesltd.com
2. The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on 14th November, 2024.
3. The company has adopted Indian Accounting Standard ("IND AS") notified by the Ministry of Corporate Affairs with effect from 1st April, 2017. Accordingly the Financial Results for the Quarter ended on 30th September, 2024 in accordance with IND-AS and other accounting principles generally accepted in India.

For Disha Resources Limited
Kishan Avtar Kakra
Managing Director
DIN : 09558817

Date : 14.11.2024
Place : Ahmedabad

MAITRI ENTERPRISES LIMITED
CIN: L45208GJ1991PLC018653
Registered Office : "Gayatri House", Ashok Vihar, Near Maitri Avenue Society, Opp. Government College, Motera, Sabarmati, Ahmedabad-380005, Gujarat, E-mail id : compliance@maitrienterprises.com, Phone No : 079-275 0840/27571340, website : www.maitrienterprises.com

EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2024
(Rs. in Lakhs)

PARTICULARS	Quarter Ended		Half Year Ended		Year Ended	
	September 30, 2024 Audited	June 30, 2024 Audited	September 30, 2023 Audited	September 30, 2024 Audited		
Total income from operations (net)	742.94	771.84	328.15	1514.78	676.99	
Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	59.21	21.00	0.56	80.41	(0.28)	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	59.41	21.00	0.56	80.41	(41.69)	
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	43.41	14.71	0.42	57.98	(44.95)	
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	43.42	15.23	0.42	58.56	(44.95)	
Equity Share Capital	440.00	440.00	440.00	440.00	440.00	
Earnings Per Share (face value of Rs. 1/-each) (for continuing and discontinued operations)	Basic :	0.99	0.33	0.01	1.32	-0.01
	Diluted :	0.99	0.33	0.01	1.32	-0.01

Extract of Standalone Unaudited Financial Results for Quarter and Half year ended September 30, 2023

PARTICULARS	Quarter Ended		Half Year Ended		Year Ended
	September 30, 2024 Audited	June 30, 2024 Audited	September 30, 2023 Audited	September 30, 2023 Audited	
Total Income from Operations	741.26	789.35	301.38	1510.61	618.69
Profit Before Tax	65.11	22.40	7.76	87.52	15.40
Profit After Tax (After Other Comprehensive Income)	48.98	16.11	5.81	65.09	11.53

Notes: The above is an extract of the detailed format of Financial Results for the Quarter and Half Year ended on September 30, 2024 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Company i.e. www.maitrienterprises.com and on the website of BSE Ltd (www.bseindia.com).

For, MAITRI ENTERPRISES LIMITED,
SD/-,
MR. JAIKISHAN R. AMBANI
MANAGING DIRECTOR
DIN: 03528680

Date : November 14, 2024
Place : Ahmedabad

SYMBOLIC POSSESSION NOTICE
ICICI Bank | Branch Office: ICICI Bank Ltd Office Number 201-5, 2nd Floor, Road No. 1 Plot No. 53, WIT IT Park, Wagle Industrial Estate, Thane (West) - 400004

The Authorised ICICI Bank Officer under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued Demand Notices to the borrower(s) mentioned below, to repay the amount mentioned in the Notice within 60 days from the date of receipt of the said Notice.

Having failed to repay the amount, the Notice is issued to the borrower and the public in general to give notice on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower and the public in general are hereby cautioned not to deal with the property. Any dealings with the property will be subject to charges of ICICI Bank Limited.

Sr. No.	Name of the Borrower(s)/Loan Account Number	Description of Property/ Date of Symbolic Possession	Date of Demand Notice / Amount of Demand (Rs)	Name of Branch
1.	Ankit Ram Singh & Ritu Rom Singh - LBVP00005860044	Flat No. B-401, 4th Floor, B-Building, Anjan Shaloka, Near Tirupati Plaza, Survey No. 334/B, Vapi To Daman Road, Challo, Valsod, Vapi - 395191/ November 12, 2024	June 24, 2024 Rs. 31,04,003/-	Vapi
2.	Rajeev Kumar Yadav & Sushma Devi - LBVP00005605680	Flat No. 305, 3rd Floor, Wing-C, 1, Tower-C, Rama Residency, Extension Of Dada Street, Block/ Survey No. 826, Old Survey No. 61/1/3, Namdha Road, Valsod, Vapi - 396191/ November 12, 2024	June 12, 2024 Rs. 15,95,531/-	Vapi
3.	Makwana Chetanbhai & Makwana Khimji - LBKN00004579603	Flat No. 48, Yeshwanth Nagar-1, Near Sonshidhar Khimji, Khambhalya, Dev Bhoomi Dwaraka - 361305/ November 12, 2024	July 29, 2024 Rs. 21,12,229.42/-	Dev Bhoomi Dwaraka
4.	Solaniki Govindbhai Jyotsnabai & Solanki Manishaben Govindbhai - TBJAM00006878264	All That Piece And Parcel Of Immovable Residential Property Having Area Adm. 43-55 Sq. Mtrs. Of Sub Plot No. 202 Of Revenue Survey No. 487/ Paikae-5 Located At Village: Ramnagar, Tal: Khambhalya & TBJAM00006878264	June 21, 2024 Rs. 7,48,176/-	Jam-nagar
5.	Ganotra Dhairyay Shalleshbhai & Ganotra Rishi - LBRAJ00005531318	Flat No. 302, 3rd Floor, Building-C, R.K. Dreamland-2, Near Morbi Jankt Naka, R.S. No. 72/1 Paik 4, T.P.S. No. 12, F.P.No. 2 Paik, 3 Paik, Plot No. 12, S.P. No. 12/1 To 1/25, C.T.S. Ward No. 13, C.T.S. No. 3768/1/12, Off Morbi Road, Rajkot - 360005/ November 12, 2024	June 06, 2024 Rs. 16,85,599/-	Rajkot
6.	Maghuda Jitesh & Maghuda Budhiben - LBKN00005842703	Sub Plot No. J/2, Shivalay Park, Behind Takshshila School, R.S. No. 610/ Paik 1, Off. Bethook Road, Dasturpur, Khambhalya, Devbhoomi Dwaraka - 361605/ November 12, 2024	May 28, 2024 Rs. 11,52,513.45/-	Khambhalya
7.	Meena Mukesh Joshi & Vanitaben Nathalal Joshi & Hitesh Nathalal Joshi - LBPR00005112412 & LBPR00005112426	Plot No. 6, Sahimuni Green Park, S. No. 8, Near Parinar Society, Chaya Bank Colony, Survey No. 391/P, Lunagadh, Porbandar - 360575/ November 12, 2024	December 04, 2023 Rs. 1,00,02,927.00/-	Porbandar

The above-mentioned borrowers(s)/guarantor(s) is/are hereby issued a 30 day Notice to repay the amount, else the mortgaged properties will be sold after 30 days from the date of publishing this Notice, as per the provisions under Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date: November 15, 2024
Place: Gujarat
Sincerely Authorised Signatory
For ICICI Bank Ltd.